

ઓક્ટોબર 3 - 9 હાથ ધરાશે બ્રેમ્પટન આગ નિવારણ સપ્તાહ

બ્રેમ્પટન, ઓન્ટારિયો (01 ઓક્ટોબર 2021) – ઓક્ટોબરની 3જી થી 9મી સુધી બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટન અને ઈવેન્ટના પ્રાયોજક એનબ્રિજ ગેસ (Enbridge Gas) કમ્યુનિટીને આગ સામેની સુરક્ષા અને તૈયારી અંગે પ્રશિક્ષિત કરવા માટે આગ નિવારણ સપ્તાહ (Fire Prevention Week) મનાવી રહ્યા છે. આ વર્ષેની થીમ છે "આગની સુરક્ષાના અવાજો ઓળખો (Learn the Sounds of Fire Safety)!" જે નેશનલ ફાયર પ્રોટેક્શન અસોસિએશન (NFPA) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે અને જેનો ધ્યેય એવા વિવિધ અવાજો અંગે જાગૃક્તા ઊભી કરવાનો છે જે સ્મોક અને કાર્બન મોનોક્સાઇડ (CO) એલાર્મ વગાડે છે.

આગની સુરક્ષાના મહત્વના અવાજો જાણવાથી જીવન બચાવવામાં સહાયતા મળે છે. એકલ કિલકિલાટ, બે વખત થતો કિલકિલાટ અને બીપના અવાજો વચ્ચેનો તફાવત જાણવાથી તમે કોઈપણ પરિસ્થિતિઓ માટે તૈયાર રહી શકશો.

- મોટેથી વાગતા ત્રણ બીપના અવાજનો અર્થ ધુમાડો અથવા આગ. બહાર નીકળો, બહાર જ રહો અને 9-1-1 ને કોલ કરો
- દર 30 થી 60 સેકન્ડે એક કિલકિલાટનો અર્થ થયો કે બેટરી ઉતરી ગઈ છે અને બદલવી પડશે.
- બેટરી બદલ્યા પછી પણ કિલકિલાટ ચાલુ રહે એટલે એલાર્મ તેની આવરદા વટાવી ચુક્યું છે અને યુનિટ બદલવું પડશે. દર 10 વર્ષ બાદ તમામ સ્મોક એલાર્મ બદલી નાંખવા જોઈએ.

ખાતરી કરી લેશો કે સ્મોક અને કાર્બન મોનોક્સાઇડ (CO) એલાર્મ તમામ પરિવારજનોની જરૂરિયાતો પૂર્ણ કરે જેમાં શારીરિક કે સંવેદનાત્મક વિકલાંગતા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. એવા વ્યક્તિઓ જેમને સાંભળી શકાતા એલાર્મના અવાજો સંભળાતા ન હોય, તેમને માટે દેખાય એવા એલાર્મ અથવા વિઝ્યુઅલ ઈમર્જન્સી એલર્ટિંગ સિસ્ટમ રાખવી જેથી કટોકટીના સમયે ચેતવણી મળી શકે.

આગ નિવારણ સપ્તાહ દરમિયાન બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસને અહીં ફોલો કરો [Twitter](#), [Facebook](#), અને [YouTube](#) જ્યાં તમને સલામતીના સૂચનો અને સુરક્ષાના અવાજો કેવી રીતે ઓળખવા તે અંગે માહિતી મળશે.

બ્રેમ્પટન આગ નિવારણ સપ્તાહના પ્રાયોજક એનબ્રિજ ગેસનો આભાર કે તેમણે બ્રેમ્પટનની કમ્યુનિટીમાં તેમનો ઉદાર ટેકો આપવો ચાલુ રાખ્યો છે. પોતાને અને પોતાની આસપાસના લોકોને સલામત રાખવા માટે દરેકજણ પાસે સરળ પણ અગત્યના આગ અંગેના સલામતીના પગલાં લેવાની શક્તિ હોય છે.

સુવાક્યો

"ચાલી રહેલ આગ સલામતી અને સુરક્ષા શિક્ષણ બ્રેમ્પટન કેવી રીતે સ્વસ્થ અને સુરક્ષિત શહેર બની શકે તેમાં યોગદાન આપે છે. આ આગ નિવારણ સપ્તાહમાં હું બધાને સલામતીના અવાજોથી વાકેફ થવા પ્રોત્સાહિત કરું છું જેથી પોતાને અને પોતાના પરિવારોને સુરક્ષિત રાખી શકાય."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"સુરક્ષાનો પ્રારંભ તમારાથી થાય છે. હું રહેવાસીઓને પોતાની સલામતી માટે સક્રિય રહેવા, સલામતીના અવાજો જાણી લેવા અને પોતાના સ્મોક અને કાર્બન મોનોક્સાઇડના એલાર્મની જાળવણી કરતા રહેવા પ્રોત્સાહિત કરું છું કારણકે તે જીવ બચાવે છે."

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રેમ્પટનના પ્રમુખ

"સ્મોક (ધુમાડો) એલાર્મ જીવ બચાવે છે અને જ્યારે યોગ્ય રીતે બેસાડવામાં આવે અને જાળવવામાં આવે ત્યારે તે આગથી થતા મૃત્યુ અને ઈજાઓ ઘટાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. સ્મોક અને કાર્બન મોનોક્સાઇડ એલાર્મના વિવિધ અવાજો જાણી લેવા અગત્યના છે જેથી તમે યોગ્ય પગલાં લઈ શકો. ધરના દરેક સભ્ય તેમના એલાર્મના અવાજો અને તેની સામે શું પ્રતિભાવ આપવા તે સમજે એ ખૂબ જરૂરી છે."

- બિલ બોચ, ફાયર ચીફ, બ્રેમ્પટન ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

પ્રભજોત કૈન્થ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Prabhjot.Kainth@brampton.ca